



જનસંપર્ક અધિકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૧૨/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૮૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૮ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૫૧ લીટર દેશી દારૂ, ૨૬૮ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૨૦ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૪૦ બિયર ટીન, ૧ લકઝરી બસ અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૦,૧૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૮૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૨૪૮૭/૧૮

કાલુપુર: લક્ષ્મીચંદ નેચલદાસ રામચંદાની (ઉ.વ.૬૯)(રહે.સુર્યદિપ ટાવર સર્જન ટાવરની બાજુમાં એસ.બી.આઈ બેન્ક સામે મેમનગર ગુરૂકુળ) એ તા.૨૩/૧૨/૧૮ નારોજ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૭/૨૦૧૭ કલાક ૧૧/૦૦ વાગે રેવડી બજાર કાલુપુર કોર્ટની રાંગ, નેતાજી માર્કેટ ખાતે આરોપી (૧) પંકજ રામનીવાસ અગ્રવાલ (ઓફીસ: સફલ-૨, વાણીજ્ય ભવન પાસે, રાયપુર) (૨) રતનકુમાર પ્રભુરામ પટેલ (ઓફીસ:સફલ-૨ (સુમેલ બીજનેસ પાર્ક-૨) વાણીજ્ય ભવન રાયપુર) (૩) કમલ ભવનદાસ છાબલાની (ઓફીસ: મારૂતીનંદ કોમ્પલેક્ષ માધવબાગની સામે, સારંગપુર) (૪) પવનકુમાર ભુરાલાલ શર્મા (ઓફીસ: પ્રતિભા-૧, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સામે આશ્રમરોડ) (૫) સુરેશકુમાર જૈન (ઓફીસ : બીજો માળ, સફલ-૨, વાણીજ્ય ભવન પાસે, રાયપુર) (૬) મુકેશ પુરણચંદ્ર બંસલ (ઓફીસ: સફલ-૨, વાણીજ્ય ભવન પાસે, રાયપુર) અને (૭) કૌશલ અરવિંદભાઈ કેલ્યા (ઓફીસ : પહેલો માળ, સફલ-૪, કાલુપુર નાકા પાસે, કાલુપુર) એ ભેગા મળી લક્ષ્મીચંદને વિશ્વાસમાં લઈ શર્ટીંગ કાપડ માલ કિંમત રૂપિયા ૯,૫૨,૦૮,૪૦૨/- ખરીદી કરી નાણા નહીં ચુકવી, લક્ષ્મીચંદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી આર.જી.દેસાઈ ચલાવે છે.

સાઈબર ક્રાઈમ: નીતીનભાઈ ચીનુભાઈ શાહ (ઉ.વ.૬૪)(રહે.ગેલેક્સી ટાવર, ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે બોડકદેવ) એ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૧૨/૧૮ નારોજ નીતીનભાઈના ક્રેડિટકાર્ડ દ્વારા અજાણી વ્યક્તિએ ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ૯૨,૪૯૬/- ટ્રાન્ઝેક્શન કરી મેળવી લઈ નીતીનભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.ચૌધરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૪૮૮/૧૮

કાગડાપીઠ: વૈશાલીબહેન વા/ઓફ સેલ્વમભાઈ મુદલીયાર (ઉ.વ.૨૮) (રહે.કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટ દિવાન બલ્લુભાઈ સ્કુલ સામે વાણિજ્ય ભવનની સામે પાછળ કાંકરીયા) એ અગમ્ય કારણસર તા.૯/૧૨/૧૮ કલાક ૯/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૨૩/૧૨/૧૮ કલાક ૮/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.બી.પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.